



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૪/૨૦૧૯ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૪૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૯૭ કેસ કરી, ૯૨ વ્યક્તિઓને ઝડપી, ૨૧૦ લીટર દેશી દારૂ, ૨૬૩ બોટલ ઇંગ્લીશ દારૂ, ૫૫૩ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૧૨૦ બીયરટીન ૦૨ કાર અને ૦૨ સ્કુટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૧૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૯,૩૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૪૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૮૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૬૪૨/૧૯

પાલડી : કલ્પીતાબહેન વા/ઓ અસીમભાઈ કોરાડીયા (ઉ.વ.૨૯)(રહે.અશોકનગર સોસાયટી લીટલ ફ્લાવર સ્કુલની બાજુમા પાલડી) તા.૦૯/૦૪/૨૦૧૯ રાતના ૦૮/૪૫ વાગ્યાના સુમારે પાલડી વિકાસગૃહ રોડ શ્રીરંગ એપાર્ટમેન્ટની પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલા બે પુરૂષ કલ્પીતાબહેન ના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મતાનો ખેંચી તોડી લઈ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ કલ્પીતાબહેન કોરાડીયા એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.એમ.રાઠોડ ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૬૪૩/૧૯

ચાંદખેડા : મહેશભાઈ અંબાલાલ પટેલ (રહે.રાયચંદનગર સોસાયટી, વિસત પેટ્રોલપંપ ની પાસે મોટેરા રોડ ચાંદખેડા) એ તા.૧૦/૦૪/૨૦૧૯ ના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૪/૨૦૧૯ રાતના ૧૧/૦૦ થી તા.૦૩/૦૪/૨૦૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન પોતાની સોસાયટીના મેદાનમાં પાર્ક કરેલ પોતાની મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે.-૦૧-ઇ.ટી.-૪૦૦૫ કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦/- મતાની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.વી.ચૌધરી ચલાવે છે.

મેઘાણીનગર: જશોદાબહેન વા/ઓફ નરોત્તમભાઈ પરમાર (ઉ.વ.૬૧) (રહે. કિસ્મતનગર સોસાયટી શારદા સ્કુલ પાસે કલાપીનગર મેઘાણીનગર) તા.૮/૪/૧૯ કલાક ૯/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે આ બનાવતા હતા ત્યારે ઝાળ પહેરેલ કપડાને અડી જતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૯/૪/૧૯ રાતના ૧૧/૫૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સાબરમતી: કિંજલબહેન વિક્રમભાઈ ઠાકોર (ઉ.વ.૧૯) (રહે. ગાંધીવાસ-૧ પરમેશ્વરની ચાલી સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૧૦/૪/૧૯ કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છત ઉપરની પાઇપ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અતુલભાઈ કાંતીલાલ ચલાવે છે.

નિકોલ: કોમલ વિશાલ ગૌરૈયા (ઉ.વ.૨૨) (રહે. સહજાનંદ વિલા સોસાયટી રામજી મંદીર પાસે નિકોલ) એ અગમ્ય કારણસર તા.૯/૪/૧૯ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ મદદનીશ પોલીસ કમિશનર શ્રી “આઈ” ડીવીઝન ચલાવે છે.

ઇસનપુર: ખુશ્બુબહેન ડો/ઓ પ્રકાશભાઈ યુનારા (ઉ.વ.૧૭) (રહે. ઘાટીયાનગર રબારી વાસ સરદાર પટેલ સ્કુલ પાછળ ઇસનપુર) એ અગમ્ય કારણસર તા.૯/૪/૧૯ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઇસનપુર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.